

ત્વરિત જાહેરાત માટે

Seedy Saturday (સીડી સેટરડે)નાં દસ વર્ષો! વસંતઋતુના આગમનની શરૂઆત

2022 નાં વર્ચ્યુઅલ સીડી સેટરડે અને ગાર્ડન શો સાથે કરો

બ્રમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 1, 2022) – સીટી ઓફ બ્રમ્પટનના સીડી સેટરડે (પુષ્કળ બીવાળો શનિવાર) અને બગીચાનું પ્રદર્શનના દસ વર્ષ શનિવાર, માર્ચ 12 નાં રોજ, સવારે 10 વાગ્યાથી ઓનલાઇન આયોજન સાથે ઉજવાશે.

2022 વર્ચ્યુઅલ સીડી સેટરડે અને ગાર્ડન શોને બ્રમ્પટન હોર્ટિકલ્ચરલ સોસાયટી સાથેની ભાગીદારીમાં રજૂ કરવામાં આવે છે, અને તેમાં આ પર્યાવરણલક્ષી નિષ્ણાતોના બગીચાકામના વીડિયો દર્શાવવામાં આવશે:

- જેમ્સ ગ્રેહામ (James Graham) - ચડિયાતા સૂચનો વડે ચડિયાતા શાકભાજી ઉગાડો
- કેથી નેસબિટ (Cathy Nesbitt) - અળસિયા વડે ઓર્ગેનિક મેજિક
- લિન્ડા ક્રેગો (Linda Crago) - હેઈરલૂમ્સ એન્ડ સીડ સેવિંગ
- શેલી કેન્ડેલ (Shelly Candell) - પરાગરજનું મહત્વ
- બોબ વાઈલ્ડફોંગ (Bob Wildfong) - સફળ બિયારણ બચાવતો બગીચો ઉગાડો
- સીન જેમ્સ (Sean James) - જમીન અને તેમાં જીવતી વસ્તુઓ
- ક્રિસ્ટોફર બાયલેક (Christopher Bialek) - બદલાતી આબોહવામાં બગીચાકામ
- એડ હનવિક્સ (Ed Hunwicks) અને ટ્રેવર લી (Trevor Lee) - સીટી ઓફ બ્રમ્પટનના વૃક્ષો માટે કરવા જેવી ન કરવા જેવી બાબતો પર વાતચીત

તમારા માટે બગીચાકામ નવું હોય કે પછી તમે એક કરાચેલા વ્યવસાયી હો, માર્ચ 13 નાં રોજ આખો દિવસ વેબસાઈટ www.brampton.ca/seedysaturday જોઈને બગીચાકામ સંબંધિત સંસાધનોની પહોંચ મેળવો, સ્થાનિક બગીચાકામ સંબંધિત વિક્રેતાઓના સંપર્કમાં આવો, છાપી શકાતી પ્રવૃત્તિઓ અને વીડિયો ટ્યુટોરિયલ્સ સાથે કિડ્સ ઓનનો આનંદ માણો, [બ્રમ્પટન હોર્ટિકલ્ચરલ સોસાયટી](http://www.brampton.ca/seedysaturday) સાથે કર્બસાઈટમાં બિયારણની અદલાબદલી કરવામાં ભાગ લેવાની રીત વિશે, અને ઘણું જાણો.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રમ્પટન એક હરિયાળુ શહેર છે, અને અમે રહેવાસીઓને બગીચાકામ અને બાગાયત ખેતી વિશે શીખવા પ્રોત્સાહિત કરીએ છીએ. બ્રમ્પટનના વર્ચ્યુઅલ સીડી સેટરડે અને ગાર્ડન શોની શનિવાર, માર્ચ 12 નાં રોજ શોધખોળ કરો, અને અમારી સાથે આ ક્લાસિક ઇવેન્ટના 10 વર્ષો ઉજવો!”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“દર વર્ષે, બ્રેમ્પટનનો સીડી સેટરો અને ગાર્ડન શો વસંતઋતુની શરૂઆત કરવા બગીચાકામના નિષ્ણાતો, ઉત્સાહીઓ અને બાગાયત ખેતી કરતા નવા લોકોને સાથે લાવે છે. માર્ચ 12 નાં રોજ અમારી સાથે ઓનલાઇન જોડાઈને નિષ્ણાત સેમિનાર વીડિયો જુઓ અને સમુદાયના ભાગ તરીકે બગીચાકામની માહિતી અને સંસાધનો સુધી પહોંચ મેળવો.”

- રોવિના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“બગીચાકામ એક ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ છે જેનાથી સમુદાયના આરોગ્ય અને સુખાકારીને ટેકો મળે છે. આ વર્ષે, માર્ચ 12 નાં રોજ બ્રેમ્પટનના 10^{મી} વાર્ષિક સીડી સેટરો અને ગાર્ડન શો ઓનલાઇનમાં નિષ્ણાત વીડિયો, બાળકોની પ્રવૃત્તિઓ, કર્બસાઈડ સીડ સ્વેપ (બીયારણની અદલાબદલી) અને ઘણું બધું માણો.”

- શર્મેઈન વિલિયમ્સ (Charmaine Williams), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“અમે આ વર્ષે બ્રેમ્પટન હોર્ટિકલ્ચર સોસાયટી સાથે બ્રેમ્પટનનો 10^{મી} વાર્ષિક સીડી સેટરો અને ગાર્ડન શો રજૂ કરવા આશાવાદી છીએ. બગીચાકામ, ટકાઉપણું અને હરિયાળા જીવન વિશે વધુ જાણો!”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના CAO, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડામાં સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકી એક, બ્રેમ્પટન 7,00,000 લોકો અને 75,000 ધંધાઓનું ઘર છે. આપણે જે કંઈ કરીએ છીએ તે લોકોના હૃદયમાં વસે છે. આપણને આપણાં વૈવિધ્યસભર સમુદાયોથી સ્કૂર્તિ મળે છે; આપણે રોકાણ આકર્ષીએ છીએ, અને આપણે ટેકનોલોજીલક્ષી અને પર્યાવરણલક્ષી નવીન શોધની આગેવાની કરવાનું કામ હાથમાં લઈએ છીએ. આપણે પ્રગતિ સાધવા ભાગીદારી કરીને એવું આરોગ્યપ્રદ શહેર નિર્માણ કરીએ છીએ જે સુરક્ષિત, કાયમી અને સફળ રહે. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાઈ જવ. વધુ માહિતી અહીં મેળવો, www.brampton.ca

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

multiculturalmedia@brampton.ca